

Nuvoco Vistas's Rs. 5,000 cr. IPO to open on August 09, 2021

Ahmedabad, Nuvoco Vistas Corporation Limited ("Nuvoco Vistas" or the "Company"), is the fifth largest cement company in India and the largest cement company in East India in terms of capacity and one of the leading ready mix concrete manufacturers in India (Source: CRISIL Report). As of March 31, 2021, the Company had 11 Cement Plants with a consolidated installed manufacturing capacity of 22.32 MMTPA. The Company's leadership team is led by Mr. Hiren Patel, Chairman and Non-Executive Director and Mr. Jayakumar Krishnaswamy,



Managing Director. Nuvoco Vistas is proposing to open its initial public offering of Equity Shares (the "Offer") on Monday, August 09, 2021 and close on Wednesday, August 11, 2021. The price band for the Offer has been determined at Rs. 560 - Rs. 570 per Equity Share. The total Offer size is up to Rs. 5,000 crores with a fresh issuance of Equity

Shares, aggregating up to Rs. 1,500 crores and an offer for sale of Equity Shares aggregating up to Rs. 3,500 crores, by Niyogi Enterprise Private Limited (the "Promoter Selling Shareholder"). The Company intends to utilize the proceeds of Rs. 1,350 crores from the fresh issue for repayment/prepayment/redemption, in full or part, of certain borrowings availed of by our Company, besides general corporate purposes. ICICI Securities Limited, Axis Capital Limited, HSBC Securities and Capital Markets (India) Private Limited, JP Morgan India Private Limited and SBI Capital Markets Limited are the book running lead managers to the Offer ("BRLMs").

Chemplast Sanmar fixes IPO price band at Rs. 530-541 per share

MUMBAI, Chemplast Sanmar Ltd has fixed the price band for its initial public offering between Rs. 530 and Rs. 541 per share. Earlier, the chemical company said its IPO will open on 10 August and close on 12 August. Chemplast Sanmar's IPO, backed by Canadian billionaire Prem Watsa, will raise Rs. 3,850 crore. The offer consists of a fresh issue of Rs. 1,300 crore and an offer for sale (OFS) of Rs. 2,550 crore by its current promoters and shareholders. The OFS comprises sale of Rs. 2,463.44 crore by Sanmar Holdings, Rs. 86.56



crore by Sanmar Engineering Services Ltd. The company is a part of the Chennai-based industrial conglomerate Sanmar Group, which has interests in chemicals, shipping, and engineering. It manufactures PVC, chlorochemicals, caustic soda, hydrogen peroxide, and refrigerant gases, and also has a contract manufacturing segment. The proceeds from the issue will be used for an early redemption of non-convertible debentures worth Rs. 1,238.25 crore. Rating firm Brickworks has revised its rating on the company to negative from

stable due to weaker than expected earnings in FY20 amid higher interest outgoes. The rating firm noted that "Until six months FY20 (audited), the gearing and debt metrics were comfortable in view of the low level of debt. However, FY20 onwards, these were being impacted because of the additional debt by way of NCDs raised in December 2019 and higher coupon payments. The debt-equity ratio increased to 1.42 times for FY20 (0.18 times as on 31 March 2019). The interest service coverage ratio (ISCR) and debt service coverage ratio (DSCR) declined to 3.35 times and 1.76 times, respectively, for FY20, against 6.88 times and 2.58 times, respectively, for FY19."

Business Brief

UTI Mutual Fund launches 'UTI Focused Equity Fund'

Mumbai, UTI Mutual Fund launches an open-ended equity scheme investing in maximum 30 stocks across market caps - 'UTI Focused Equity Fund'. The New Fund Offer opens on August 04, 2021 and closes on August 18, 2021. The scheme will re-open for subscription and redemption for an ongoing basis from August 26, 2021. The investment objective of the scheme is to generate long term capital appreciation by investing in equity and equity related instruments of maximum 30 stocks across market caps. However, there can be no assurance or guarantee that the investment objective of the scheme would be achieved. Mr. Sudhanshu Asthana is the Fund Manager of the scheme. Mr. Sudhanshu said, "Focused investing is all about high-conviction and our philosophy has two dimensions to generate portfolio alpha. The first is to hand-pick a select set of companies from the larger universe by relying on our ScoreAlpha investment philosophy aided by rich experience in research and fund management to separate the wheat from the chaff. Second is to build the portfolio to demonstrate the conviction by building significant portfolio positions in each company, which may accentuate the portfolio outcome."

Volvo Car India introduces 24x7 Customer Service Support

New Delhi, Swedish luxury carmaker Volvo Car India today announced the commissioning of a 24x7 customer support service. The Consumer Relations Centre (CRC) reachable at a toll free number 18001029100 has started to provide Customer Service, queries handling & Roadside Assistance to all Volvo customers. This Centre is also unique as it makes India the only country in the Volvo Asia Pacific ecosystem to provide round the clock customer support. "We pride ourselves in being a customer centric company and this is our latest offering towards superior customer satisfaction. The Consumer Relation Centre enhances customer confidence in the brand with the conviction that the company is contactable round the clock, year round in the unlikely event of a customer having to reach out. We are committed to grow the Indian market and will continue to invest in initiatives that focus on customers" said Mr. Jyoti Malhotra, Managing Director, Volvo Car India. The company introduced several customer centric initiatives during the past 12 months including 'Volvo Contactless Program' to ensure customer safety and to promote online purchase. Volvo Car India is committed towards bringing the latest technologies in upcoming cars for customer convenience.

LANXESS completes acquisition of Emerald Kalama Chemical

Mumbai, Specialty chemicals company LANXESS completed the second-largest acquisition in its history on August 3 with the takeover of Emerald Kalama Chemical. The US-based specialty chemicals manufacturer was majority-owned by affiliates of private equity firm American Securities LLC. All required regulatory approvals have been received. The enterprise value of Emerald Kalama Chemical was USD 1.075 billion (EUR 900 million). After deducting liabilities, the purchase price was approximately USD 1.04 billion (EUR 870 million), which LANXESS financed from existing liquidity. "Emerald Kalama Chemical gives us another major boost on our growth path. The new businesses are an optimal strategic fit for us. We are strengthening our position in markets with attractive growth rates and opening up new high-margin application areas, especially in the beverage and food sector or in cleaning and cosmetic products. What's more, Emerald

Kalama Chemical is perfectly backward integrated - strengthening our value chain in Consumer Protection. This segment is thus an important engine on the way to making LANXESS even more stable and profitable," said Matthias Zachert, Chairman of the Board of Management of LANXESS AG. "A strong team is now working at full speed to ensure a rapid integration." With the closing of the transaction, LANXESS grows by around 470 employees and the three production sites in Kalama/Washington

(USA), Rotterdam (Netherlands) and Widnes (Great Britain). In 2020, Emerald Kalama Chemical achieved global sales of approximately USD 425 million (EUR 375 million) and EBITDA pre exceptional of around USD 90 million (EUR 80 million). Within three years, LANXESS expects an additional annual EBITDA contribution of around USD 30 million (EUR 25 million) from synergy effects. The acquisition will already be earnings per share accretive in the first fiscal year after its completion.

(USA), Rotterdam (Netherlands) and Widnes (Great Britain). In 2020, Emerald Kalama Chemical achieved global sales of approximately USD 425 million (EUR 375 million) and EBITDA pre exceptional of around USD 90 million (EUR 80 million). Within three years, LANXESS expects an additional annual EBITDA contribution of around USD 30 million (EUR 25 million) from synergy effects. The acquisition will already be earnings per share accretive in the first fiscal year after its completion.

Petrol, diesel prices unchanged for 19th consecutive day

New Delhi, Oil marketing companies (OMC) continued to pause fuel price revision for the nineteenth consecutive day on Thursday as wait and watch continues amid fluctuating global crude prices. Global crude prices have swung in all directions in July starting with a low of \$70 a barrel to quickly rise to over \$77 a barrel, only to fall soon below \$70 a barrel and crossing \$75 a barrel later in the month. The oil prices have softened again to just over \$70 a barrel on concerns of growing Covid cases, slowing industrial recovery globally and rising US oil inventory. With no price increase by OMCs, in the national capital, petrol continued to

be sold for Rs 101.84 per litre, while diesel was also being sold at the unchanged price of Rs 89.87 a litre on Thursday. The pump price of fuel has been static since July 18. In the city of Mumbai, where petrol prices crossed the Rs 100-mark for the first time ever on May 29, the fuel price is at Rs 107.83 per litre. Diesel price in the city is also at Rs 97.45, the highest among metros. Petrol price in all metros has now crossed the Rs 100 per litre mark. In Chennai, petrol is priced at Rs 102.49 a litre and Kolkata Rs 101.08 a litre. Diesel is also priced at Rs 94.39 and Rs 93.02 per litre in both cities respectively.

WESTERN RAILWAY-AHMEDABAD DIVISION
REPAIRS RELATED TO POH OF TRACK MACHINES
OFFICE OF CHIEF ENGINEER (CPOH) ADI; E-tender Notice No. 03 2021-22 date 04.08.2021; Name of work: Repairs related to POH of track Machines at CPOH ADI; **Tender No. CE-CPOH-ADI-2021-22-01;** **Approximate NIT cost:** ₹ 281851402.39; **EMD Cost:** ₹ 1609260/- (If Bidders not submit Bid security declaration.); **Date of closing of tender:** 27/08/2021 @ 11:00 Hrs; **Date of opening of tender:** 27/08/2021 @ 11:15 Hrs; **Date of uploading of tender on IREPS:** 04/08/2021
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

CHANGE OF NAME
I have changed my old name from **RANCHADIYA MAHAMADAZZIN MOHAMEDIJAJ** to new name **RANCHADIYA MOHAMADAZZIN MOHAMEDIJAJ**
Add.: Near Ghanchiwad Masjid, Soni Bazar, Kadl, Dist: Mehsana-382715
V045R

CHANGE OF NAME
I have changed my old name from **PALAKBEN RUTUL PATEL** to new name **PALAKBAHEN RUTUL PATEL**
Add.: 120, Tapovan Society, Vibhag-1 Saraspur Ahmedabad
1307

CHANGE OF NAME
I have changed my old name from **CHAUHAN SATISHKUMAR MOHANBHAI** to new name **CHRISTIAN SATISH MOHANBHAI**
Add.: New Christian Street, Nr. Railway Station, At-ta-Kathlal, Di.Kheda-387630
1306

WESTERN RAILWAY-BHAVNAGAR DIVISION
PROVIDING OF QUARTERS
No. W/118/NIT/E-Tender/2020-21/WA/15 Dated: 02/08/2021; Subject: E-Tender No. 40-2021-22; Divisional Railway, Manager (Works), Western Railway, Bhavnagar para invites e-tenders on behalf of President of India for the following works: **Sr. No. 01; E-Tender No: 40-2021-22; Name of Work:** Group Work- (1) Bhavnagar Division:- Providing 24 units Type II Quarters on replacement account for Track Men of ADEN-BTD. (2) Bhavnagar Division:- Providing 12 units Type II Quarters, 08 units Type III and 04 units Type IV Quarters for RPF; Engg and S&T Deptt.; **Tender Value:** ₹ 7,58,74,102.57; **EMD: ₹ 0.00;** **Date of Bidding Start Date:** 17/08/2021; **Date of Bidding Closing:** 31/08/2021; The NIT has been uploaded on Railway Web site www.ireps.gov.in on 02/08/2021.
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY CONSTRUCTION & OTHER MISCELLANEOUS WORKS
Dy. Chief Engineer (Construction) III, Western Railway, Pratapnagar, Vadodara-390 004, invites E-tender as per the details given below: E-Tender No.: Dy.CE/CI/III/BRC/1. Name of the work: Providing construction of balance Road under Bridge / LHS to eliminate existing level crossing No.1, B & 8B (03 Nos.) by providing cast-in-situ RCC Box with RCC Wing & Return walls, retaining wall, approach roads and other misc. work from Miyagang to Dabhoi in connection with "Gauge Conversion from NG to BG between Miyagang - Dabhoi - Samalaya Section" & "Umbrella Work of Western Railway, Approx. cost: ₹905.42 Lakhs, EMD: Nil. Availability of online Tender for bidding from 09.08.2021 To 24.08.2021 up to 15:00 Hrs. Note: Regarding detailed note containing cost of tender document (non refundable), EMD, eligibility criteria, Similar Nature of work, detailed tender conditions, please visit www.ireps.gov.in, Manual offers will not be considered. 0321
Follow us on: twitter.com/WesternRly

SARDAR SAROVAR NARMADA NIGAM LIMITED
(A Wholly Owned Government of Gujarat Undertaking)
Tender Notice No. 05 of 2021-22
On-line Tenders (E-Tendering) for following works for Sardar Sarovar Project are publicly invited by Executive Engineer, Saurashtra Branch Canal Dn.No. 3/1, 2nd Floor, Kanchan Complex, Tower Road, Botad 364710 (Phone : 02849-251446) from the contractors registered in appropriate class.

Name of work	1) Estimated cost Rs.	2) END in Rs.	3) Class	1. Tender fee	2. Time for Completion of work
Tender ID No. 475921 Providing continuous patrolling on canal, operation, maintenance and vigilant inspection of canal during Irrigation and Non-irrigation season on Botad Branch canal between Ch. 42.846 to 109.934 km including security of structures, cleaning of blockage in surface drain as directed, cleaning of waste collected near HR/CR/Escape gate/structure, supply of communication system to all gate operators for the period of one year. (2021-22)	1) Rs.86.34,187.10 2) Rs.86400.00 3) 'D'-Class and above	1) 2832.00 (including GST) 2) 12 Months			

SCHEDULE OF E-TENDERING

No.	Description of Tender documents	UP to Dt.
1	Downloading of Tender documents i.e. last Date of Downloading	12.08.2021 up to 18.00 hrs.
2	On-line submission of tender document i.e. last date of receipt of tender by SNNL.	Up to Dt. 12.08.2021 up to 18.00 hrs.
3	Physical submission of Tender fee, EMD and other documents in separate cover	On or within 7 (seven) days i.e. from Dt. 12.08.2021 to Dt. 18.08.2021 up to 18.00 hrs in the office of Executive Engineer, SBC Dn No. 3/1, Botad.
4	On line verification of EMD & other documents	On Dt. 23.08.2021 from 12.00 (if possible) in the office of the Executive Engineer, SBC Dn No. 3/1, Botad.
5	On-line Opening of Price Bid	On Dt. 23.08.2021 from 16.00 hrs. (if possible) in the office of the Executive Engineer, SBC Dn No. 3/1 Botad

The details of above notice and tender documents are available on www.snnl.nprocure.com
DDI/BVN/320/21-22

FEDBANK FINANCIAL SERVICES LTD.
Having corporate office at Kankia Wall Street, A-Wing, 5th Floor, Unit No. 501,502,511,512, Andheri-Kurla Road, Chakala Andheri East, Mumbai, Maharashtra-400093
Demand Notice under Section 13(2) of the SARFESI Act, 2002

The below mentioned borrower and co-borrower (collectively referred to as "borrowers") mortgaged their immovable property (securities) to Fedbank Financial Services Limited (hereinafter referred to as "Fedfina") and avail the loan. The said loan is classified as non-performing asset on 06/08/2019 because you have failed to pay that amount. In this connection Fedfina had issued a Demand Notice on 29/07/2021 under section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 to the addressee. The details are published here as an alternative service under section 13 (2) and Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002. You are requested to repay the amount mentioned in the Demand Notice and the accompanying interest within 60 days of the publication of this notice. In case of failure to do so, the signatory shall take such appropriate action under section 13 (4) and 14 of the Act on the said property to safe guard the interest of the Fedfina.

Details of loan number, borrowers, demand notice send under section 13 (2), amount requested and details of immovable property are given below.

LAN No	Borrower/ Co-Borrower/ Mortgagee Names	Demand Notice Date	Amount
FEDSURLAP0476583	(Borrower) 1.Mani Creaton Add- Plot No 2, 1st Floor, Balaji Industrial Service Soc 1, Opp Parekh Estate, Um Road, Surat, Gujarat- 395007. (Co-Borrower) 2. Mr. Nikhil Bharat Bachkaniwala 3. Mr. Vishal Bharatbhai Bachkaniwala 4. Mr. Bharatbhai Navnitkumar Bachkaniwala 5. Mrs. Naynaben Bharatkumar Bachkaniwala Add- Add-A 702, Simandhar Apartment, Near Ichhanath Temple, Dumas Road, Surat- 395007	29/07/2021	Rs.1,13,20,196.00/-

Schedule-A
Description of Property
(Particulars of the immovable property mortgaged to FFSI)
All right title and interest in Flat no.702 admeasuring 1550.00 sq.ft. equivalent to 144.00 sq.mtrs on 7th floor together with undivided proportionate share in undermat land of Block No. "A" of "Simandhar Apartment", constructed on the land bearing Plot Nos.1 to towards eastern side of Rev.S.No.19/B, Town planning Scheme No.5 (Umra-North) Final Plot No. 148/B of village Umra, Nehru Nagar area, Sub District Taluka Surat City, District Surat.

The said borrowers are prohibited under Section 13 (13) from transferring the asset/property, whether by lease, sale or otherwise without the prior written consent of Fedfina. Any person contravenes the provisions the said act shall be liable for punishment as specified in the said Act.

DATE: 06/08/2021
PLACE: Surat
AUTHORISED OFFICER
Fedbank Financial Services Ltd

ARCHIT ORGANOSYS LIMITED
REGD. OFFICE : PLOT NO. 25/9-A, PHASE-III, GIDC, NARODA, AHMEDABAD-382330.
CIN : L24110GJ1993PLC019941 website : www.architorg.com email : share@architorg.com Ph. +91-79-40082447

EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2021 (Rs. in Lakhs)

Particulars	For the Quarter Ended		For the Year Ended
	30-06-2021	30-06-2020	31-03-2021
Total Income from operations (net)	2,866.99	1,217.72	9,451.10
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extra Ordinary items)	290.99	83.25	468.41
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extra Ordinary items)	290.99	83.25	468.41
Net profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	290.99	83.25	500.65
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	292.27	83.25	500.65
Equity Share Capital	2,052.07	1,502.07	1,502.07
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year)	-	-	2,551.76
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
(a) Basic	1.42	0.55	3.33
(b) Diluted	1.42	0.55	3.33

NOTE : (1) The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended on 30th June, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Results for the Quarter ended on 30th June, 2021 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the Company i.e. www.architorg.com (2) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 05th August, 2021. (3) Figures for the previous periods have been regrouped / reclassified / restated wherever necessary.

For ARCHIT ORGANOSYS LIMITED
Date : 05th August 2021
Place : Ahmedabad
Sd/- Kandarp K. Amin
Chairman and Whole Time Director (DIN 00038972)

ICE MAKE REFRIGERATION LIMITED
CIN: L29220GJ2009PLC056482
Registered Office: B-1, Vasupuja Chamber, Near Navdeep Building, Income Tax Cross Road, Ahmedabad- 380009

NOTICE TO THE SHAREHOLDERS FOR 12TH ANNUAL GENERAL MEETING
NOTICE is hereby given that the 12th Annual General Meeting ("AGM") of the Company will be held on Saturday, the 25th September, 2021 at 12.00 noon through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs, vide its Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No.20/2020 dated 5th May, 2020, Circular No. 22/2020 dated 15th June, 2020 and Circular No. 02/2021 dated 13th January 2021 and also Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 ("Circulars"), have permitted the holding of AGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Members of the Company will be held through VC/OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2020-21 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2020-21 will also be available on the Company's website- www.icemakeindia.com, website of the Stock Exchange i.e. www.secdia.com and the AGM Notice will also be made available on the website of CDSL (agency for providing the Remote e-voting facility) i.e. www.evotingindia.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the notice of AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting").

Detailed procedure for remote e-voting/e-voting facility will be provided in the Notice of AGM.

Record date for Dividend and payment thereof:

1) The Company has fixed Saturday, September 18, 2021 as the "Record Date" for determining entitlement of Members to Dividend, recommended by the Board of Directors of the Company for the financial year ended March 31, 2021.

2) Subject to approval of the members at the AGM, the dividend will be paid on or before the 30th day from the date of declaration, to the members whose names appear on the Company's register of members as on the record date and in respect of the shares held in dematerialised mode, to the members whose names are furnished by the National Securities Depository Limited and Central Depository Services (India) Limited as Beneficial owners as on that date.

3) As per the relevant circulars, payment of dividend shall be made through electronic mode to those members who have updated their bank account details, dividend warrant/demand drafts will be dispatched to the registered address of the members who have not updated their bank account details, after normalisation of the postal services.

4) Payment of dividend will be subject to deduction of the tax at source (TDS) at applicable rates. For more details please refer notes to the notice of AGM.

In case Member(s) have not registered their Bank Account details (for dividend) & email addresses with the Company/ Depository, please follow the below instructions to register Bank Account details (for dividend) & e-mail address for obtaining Annual Report and login details for e-voting.

a. For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhaar Card), Bank Details along with canceled Cheque by email to our RTA, Link Intime India Private Limited on their Email id: ahmedabad@linkintime.co.in; mt.helpdesk@linkintime.co.in

b. Members holding shares in Demat mode can get their Bank Details & E-mail id registered by contacting their respective Depository Participant in their Demat account or by email to ahmedabad@linkintime.co.in; mt.helpdesk@linkintime.co.in or call 1800225533.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Marfatil Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai- 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43

For Ice Make Refrigeration Limited
Mandar Desai
Company Secretary & Compliance Officer

Place : Ahmedabad
Date : 4th August, 2021

DHARAMPUR MUNICIPALITY
E-TENDERING NOTICE NO.74 / TWO BID SYSTEM
Dharampur Municipality, Dharampur, Dist. Valsad, Gujarat invites line e-tender under 14th Finance Scheme Year - 2019-20, Year - 2017-18 Performance Grand and Year - 2019-20 from the government registered firms in appropriate category for the following works.

Sr. No.	Name of Work	Estimated Cost EMD Tender Fee Category of Registration Time Limit
1.	TENDER FOR CONSTRUCTION WORK OF STORM WATER DRAIN (BOX DRAIN) FROM THREE GATE GARDEN ROAD TO DHIRUBHAI PAPERWALA'S HOUSE AND PIPE DRAIN FROM SPORT COMPLEX TO THREE GATE STORM WATER DRAIN FOR BACKWASH OF SWIMMING POOL AND CONSTRUCTION WORK OF FOOTPATH AT THREE GATE AREA OF DHARAMPUR MUNICIPALITY UNDER 14TH FINANCE SCHEME YEARS 2016-17.	Rs. 1,11,82,900.00 Rs. 1,11,900.00 Rs. 15,000.00 ** Class & Above 9 Months from Work Order
2.	TENDER FOR CONSTRUCTION WORK OF PIPE DRAIN FROM THREE GATE TO RAJUBHAI PARMAR HOUSE'S RIVER VIA ARCH HOSPITAL AT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR, UNDER : 14TH FINANCE SCHEME YEAR 2017-18.	Rs. 96,32,100.00 Rs. 96,400.00 Rs. 5,000.00 ** Class & Above 9 Months from

MILESTONE DATES

Name of Website	https://www.nprocure.com
Start Date for Download On line Tender	On Date : 09.08.2021 up to 11:00 Hrs.
Last Date for Submission of On line Tender	On Date : 09.09.2021 up to 18:00 Hrs.
Last Date of Submitting the Tender Fee, E.M.D and relevant documents of the tender at mentioned address	Up to Date : 18.09.2021 before 18:00 Hrs. The Chief Officer, Dharampur Municipality, First Floor, Chhatrapati Shivaji Shopping Center, Beside Museum, At Dharampur, Dist. Valsad, Gujarat-India.
Date of Opening for on line Tender	Technical Bid on Date : 20.09.2021 at 12:00 Hrs. Price Bid date to be intimated later. (If possible)

For more information on above mention work visit website www.nprocure.com. Tender Fee and EMD in the Form of Demand Draft only in favour of The Chief Officer, Dharampur, Dharampur Nagarpalika in its sole discretion and without assigning any reasons whatsoever reserves the right to accept and or reject any or all Tenders. Dharampur Nagarpalika does not bind itself to accept the lowest tender.

Sd/- CHIEF OFFICER DHARAMPUR MUNICIPALITY DHARAMPUR	Sd/- CHAIRMAN WATER SUPPLY & DRAINAGE DEPARTMENT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR	CHAIRMAN PUBLIC WORKS DEPARTMENT, DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR
Sd/- CHAIRMAN STANDING COMMITTEE, DHARAMPUR MUNICIPALITY DHARAMPUR	Sd/- PRESIDENT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR	

No. INF/VAS/227/2021

DHARAMPUR MUNICIPALITY
E-TENDERING NOTICE NO. 73 / TWO BID SYSTEM
Dharampur Municipality, Dharampur, Dist. Valsad, Gujarat invites on line e-tenders under 14th Finance Scheme Year - 2019-20, Year - 2017-18 Performance Grand and Year - 2019-20 from the government registered firms in appropriate category for the following works.

Sr. No.	Name of Work	Estimated Cost EMD Tender Fee Category of Registration Time Limit
1.	TENDER FOR PROVIDING, SUPPLYING, LOWERING & LAYING & JOINTING OF D.I.KT RISING MAIN CONSTRUCTION WORK OF R.C.C. ESSE. WATER TREATMENT PLANT, PUMP ROOMS WITH ELECTRIFICATION AND SUPPLYING ERECTION AND COMMISSIONING OF PUMPING MACHINERY IN VARIOUS WATER DISTRICT OF DHARAMPUR MUNICIPALITY UNDER 14TH FINANCE SCHEME YEARS 2018-19	Rs. 7,66,92,000.00 Rs. 7,67,000.00 Rs. 15,000.00 **AA' Class & Above 18 Months from Work Order
2.	TENDER FOR CONSTRUCTION WORK OF GABION/REINFORCED SOIL WALL FROM BRIDGE BEHIND HATHIRKANA BAJAR SAMITI TO POND CORNER (PHASE - I & II) CH. 0 TO 310. AT SWARG VAHINI RIVER AT DHARAMPUR, UNDER: 14TH FINANCE SCHEME (YEAR: 2017-18)	Rs. 3,20,81,600.00 Rs. 3,20,000.00 Rs. 15,000.00 ** Class & Above 12 Months from Work order
3.	TENDER FOR CONSTRUCTION WORK OF GABION/REINFORCED SOIL WALL FROM NEAR MANARHATH BRIDGE TO CHIKKRI SALVA BRIDGE (PHASE - I, II & IV) CH-0 TO 680 AT SWARG VAHINI RIVER AT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR, UNDER : 14TH FINANCE SCHEME (YEAR: 2019-20)	Rs. 7,49,01,400.00 Rs. 7,49,000.00 Rs. 15,000.00 **AA' Class & Above 18 Months from Work Order

MILESTONE DATES

Name of Website	https://www.nprocure.com
Start Date for Download On line Tender	On Date : 09.08.2021 up to 11:00 Hrs.
Date of Pre-Bid Meeting (Off-line)	On Date : 23.08.2021
Date of Pre-Bid Meeting (Off-line)	On Date : 24.08.2021
Last date for Submission of On Line Tender	On Date : 09.09.2021 up to 18:00 Hrs.
Last Date of Submitting the Tender Fee, EMD and relevant Documents of the Tender at mentioned address	Up to Date : 18.09.2021 before 18:00 Hrs. The Chief Officer, Dharampur Municipality, First Floor, Chhatrapati Shivaji Shopping Center, Beside Museum, At Dharampur, Dist. Valsad, Gujarat-India.
Date of Opening for on line Tender	Technical Bid on Date : 20.09.2021 at 12:00 Hrs. Price Bid date to be intimated later. (If possible)

For more information on above mention work visit website www.nprocure.com. Tender Fee and EMD in the Form of Demand Draft only in favour of The Chief Officer, Dharampur Nagarpalika, Dharampur, Dharampur Nagarpalika in its sole discretion and without assigning any reasons whatsoever reserves the right to accept and or reject any or all Tenders. Dharampur Nagarpalika does not bind itself to accept the lowest tender.

Sd/- CHIEF OFFICER DHARAMPUR MUNICIPALITY DHARAMPUR	Sd/- CHAIRMAN WATER SUPPLY & DRAINAGE DEPARTMENT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR	CHAIRMAN PUBLIC WORKS DEPARTMENT, DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR
Sd/- CHAIRMAN STANDING COMMITTEE, DHARAMPUR MUNICIPALITY DHARAMPUR	Sd/- PRESIDENT DHARAMPUR MUNICIPALITY, DHARAMPUR	

No. INF/VAS/227/2021

